

દીક્ષા

આજે દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યો છે. પાંડિત સુખલાલે કહ્યું કે દીક્ષાનો સુખ્ય હેતુ જીવનશુદ્ધિ છે. અને આજે હું તે જીવનશુદ્ધિ ઉપર બોલવા માગું છું.

સમ્યગ્-જ્ઞાન, સમ્યગ્-દર્શન અને સમ્યગ્ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. પ્રથમ મનુષ્યને અમૃત બાબતનું જ્ઞાન થાય છે, પછી તેનું દર્શન થાય છે—એટલે કે તેના પર પૂર્ણ અંક્ષા જમે છે—તે એમજ છે, એવો દદ વિશ્વાસ થાય છે, અને પછી તે પ્રમાણે ચારિત્ર-વર્તન થાય છે. સર્વ તેસે છે, એવી આપણું ને દદ અંક્ષા છે, તેથી સર્વથી દૂર ભાગીએ છીએ. પણ એવી દદ અંક્ષા ધર્મના સિદ્ધાંતોમાં નથી, અસત્યથી આપણું આત્માપર મલીન પડ્હો પડે છે, અને તેથી આત્માનો સાક્ષાત્કાર થતો નથી, એવું આપણે શાબ્દથી જાણીએ છીએ, પણ તેવો દદ વિશ્વાસ નથી, તેથી આપણે ધારીવાર અસત્ય બોલવાને દોરાઈએ છીએ. માટે જ્ઞાન ચારિત્રથે પરિણામે તે વાસ્તે જ્ઞાન અને ચારિત્ર વર્ચ્યે અંક્ષાના અંક્ડાડાની જરૂર છે. જ્ઞાનને મેટે ભાગે ભગ્ન સાથે સંબંધ છે. દર્શનને—અંક્ષાને, હૃદય સાથે સંબંધ છે, જે વસ્તુ આપણું ભગ્નથી ખરી લાગી અને આપણા હૃદયે પણ સ્વીકારી તે બાબત જરૂર આપણે કરવાના. જાની આમ કરવાથી આવો ફાયદો થાય છે, એમ જ્ઞાનવડે વિચાર્યાં કરે, પણ જે તેના હૃદયમાં સ્ત્રીમ-વરાળ ન લરાય તો જ્ઞાન એકલું શું કરે? પ્રાચીન સમયમાં ગુરુઓ શિષ્યોને એકેક સૂત્રપર વિચાર કરવાને એકાંતમાં મોકલી દેતા. તેઓ જ્યાં

सुधी ते सूत्र पूर्ण रीते न समजे त्यां सुधी ध्यान करता हता. ते सूत्रनुं सत्य ज्यारे समजाय लारे तेओ। पाणि इरता हता, ज्ञेनोना पांच महावतो, हिंदुओना पांच यम, अने बौद्धोना पंचशीलना संबंधमां लभतां श्री पतंजलि ऋषि लघेछे के—

अहिंसा सिद्ध थै त्यारे क्लेवाय डे ज्यारे ते अहिंसक पुरुषनी हाजरीमां सामा भनुष्यनो वेर विरोध ज्ञतो २४. तेवीज रीते सत्यनी सिद्धि थै त्यारे क्लेवाय डे ज्यारे भनुष्यने वयनसिद्धि प्राप्त थाय. अर्थात् ते भनुष्य ज्ञे ओले ते प्रभाषे थाय. भद्रासनी हाइडोर्टना एक ज्ञे ४० वर्ष सुधी सत्य विचारवानो, सत्य बोक्खवानो अने सत्य आय रवानो प्रथत्न उर्ध्वी हतो, ज्ञेना परिणामे तेनामां अमुक उसमां सत्य शुं छे, ते पारभवानी आंतर शक्ति भीली हती, अने तेनो न्याय बंने पक्ष स्वीकारता हता. तेवी ज रीते अस्तेय प्रतनी सिद्धि थतां अनेक रत्नोनी तेने प्राप्ति थाय. अहर्यर्थनी सिद्धि थतां तेनामां अपूर्व अणशक्ति प्रकटे. अने अपरिग्रह प्रति सिद्धि थतां तेनामां पूर्वज्ञ-मरमुति थाय.

आटली प्रस्तावना पैठी ज्ञवनशुद्धिने वास्ते शुं आवश्यक छे, तेनो विचार करीओ. दशवैकालिक सूत्र लघेछे के ‘धर्म’ ए उत्कृष्ट भंगण छे, अने तेनां साधनो अहिंसा संयम अने तप छे.’ अहिंसा एटले डाइनी हिंसा न करवी ए तेनो निषेधात्मक अर्थ छे, पण अहिंसाना निश्चयात्मक अर्थमां विश्व तरक्कनो प्रेम आवी जय छे. अहिंसा एटले सर्वमां रहेला ज्ञवनने ज्ञेवुं, तेने मान आपवुं, अने ते ज्ञवन क्या इपमां प्रकट थयुं छे, ते इप तरक्क नज्जर न करतां ते ज्ञवनने चहावुं ए ज विश्वप्रेम छे. आ विश्वप्रेम भीलववाने आर भावनाओ। सहायक तरीके स्वीकारवामां आवी छे. ते प्रभोद, मैत्री, कासण्य अने उपेक्षा-माध्यस्थ्य छे. गुणानुराग कुलक जण्णावे छे के, ज्ञेना हृदयमां गुणानुराग-प्रभोदभाव छे ते तीर्थीकर पदवी

સુધીની એક પણ એવી ઉત્ત્ય સ્થિતિ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. અમુક મનુષ્યમાં અમુક ગુણ ભીલેલો જોઈજે આપણું હૃદયમાં આનંદ ઉત્પત્ત થતો હોય તો તે સૂચવે છે કે તેનામાં અક્ટ થયેલી મહત્ત્વા જોઈ આપણુંમાં અગ્કટ રહેલી મહત્વા બહાર આવવા પુંછે છે; માટે જ્યાં ગુણ, જ્ઞાન, શક્તિ વર્ગેરેમાં આપણુંને ઉત્કર્ષ લાગે, ત્યાં આપણું અંતરાત્મા પ્રસન્ન થવો જોઈએ. આપણું સમાન કક્ષાના જીવો પ્રત્યે આપણું મૈત્રીભાવ રાખવો જોઈએ, અને આપણુંથી જીનમાં, ગુણમાં, શક્તિમાં ઉત્તરતી સ્થિતિના જીવો પ્રત્યે આપણું હૃદયમાં કારૂણ્ય અથવા દ્વા અક્ટવી જોઈએ. જેઓ હુરાગહને બચતે સત્યના વિરોધી બન્યા હોય તેવા પ્રત્યે આપણું મધ્યરથ ભાવ રાખવો. તેમની પ્રશંસા કરવાથી અસત્યને પોષણ મળે, અને તેમની નિદા કરવી એ આપણું ઉત્ત્ય સ્વભાવને શોખે નહિ, માટે તેવી સ્થિતિના જીવોના સંબંધમાં મધ્યરથભાવ રાખવો એ જ ઉચિત છે.

વળી જીવનશુદ્ધ વાસ્તે ચાર દાખિએને સમજવાની જરૂર છે. તેમનાં નામ દોપદાષ્ટિ, ગુણદોપદાષ્ટિ, ગુણુદાષ્ટિ અને આત્મદાષ્ટિ અથવા સમદાષ્ટિ છે. દોપદાષ્ટિવાળો તો જ્યાં ત્યાં અવગુણ જ જણ્યાય છે. ગુણદોપ દાખિવાળો જીવ કોઈના ગુણ જુઓ, તેની પ્રશંસા કરે, પણ છેવટે એવો એક દોપ બતાવે કે તે મનુષ્યના ગુણ દંકાદ જ્ય અને સાંલળનારના હૃદય ઉપર તેના દોપની છેવટની છાપ પડે. ત્રીજ દાખિ જે ગુણુદાષ્ટિ છે, તેવી દાખિવાળો મનુષ્ય દરેક મનુષ્યમાં, બનાવમાં કે વિચારમાં સારે શું છે, તે તરફ નજર રાખે, અને સારે શું છે તેની પ્રશંસા કરે. દોપ સમજે પણ તેને જતો કરે, તે સંબંધમાં મૈન ધારણ કરે.

હવે ગુણુદાષ્ટિ કરતાં પણ એક આગળનું પગથિયું આવે છે કે જ્યાં મનુષ્ય આત્મદાષ્ટિવાળો અથવા સમદાષ્ટિવાળો બને છે. આપણું સર્વ જીવને કુમ ચાહી શકતો નથી? તેનું કારણ આત્મદાષ્ટિ

અથવા સમદિષ્ટનો અભાવ અથવા ન્યૂનતા છે. આત્મદિષ્ટ ખીલવવામાં અથમ ધર્મ વિધનરૂપ થાય છે. જે મનુષ્ય અમૃતક ધર્મને જ માને છે, તે બીજા ધર્મવાળા તરફ સમભાવદિષ્ટથી જોઈ શકતો નથી, તેથી તે તેમને યોગ્ય રીતે ચાહી શકતો નથી. સ્વહેશપ્રેમ એ કુટુંબપ્રેમ કરતાં કે નગરપ્રેમ કરતાં કે પ્રાંત પ્રત્યેના પ્રેમ કરતાં મહાન છે, અને મનુષ્યનાનિનો મોટો ભાગ હજુ તે સ્થિતિએ પહોંચ્યો જય છે, પણ સ્વહેશપ્રેમ જે બીજા દૈશના લોડો પ્રત્યે દ્રેપ કે અભાવ ઉત્પત્ત કરવાનું કારણ બને તો તે સ્વહેશપ્રેમ પણ મર્યાદિત હોઈ આત્મદિષ્ટ ખીલવવામાં અંતરાયભૂત અને છે. તેવી જ રીતે મનુષ્યનું બાધ્યતર અને તેણું મેળવેલી ડીઓઝો જે તેને તેના માનવબંધુઓથી અલગ બનાવે તો તે બાધ્યતર અને તે ડીઓઝો પણ આત્મદિષ્ટ ખીલવવામાં અડચણું રૂપ બને છે. આત્મદિષ્ટિવાળો અથવા સમભાવી અથવા જીવનપ્રેમી જીવ તો દરેક જીવને ચાહે છે. તે ભેદો તરફ દિષ્ટ નહિ કરતાં દરેકની પાછળ રહેલા જીવનને જુઓ છે અને ચાહે છે. પ્રાર્થનાથ પ્રલુબો કમઠ અને ધરણેંદ્ર અને ઉપર આ દિષ્ટથી સમભાવ રાખ્યો હતો. કમઠે તેમને ઉપસર્ગ કર્યા, અને ધરણેંદ્ર તેમને સહાય આપી, છતાં પાર્થનાથ પ્રલુની દિષ્ટ બને ઉપર સમાન હતી, કારણું કે તે અનેની પાછળ રહેલું જીવન જોઈ રહ્યા હતા. જ્યારે મનુષ્ય આવી આત્મદિષ્ટ ખીલવે છે, ત્યારે તે સર્વત્ર જીવનને જુઓ છે, અને સર્વ તરફ પ્રેમભાવ રાખ્યી શકે છે, અને કોઈ તેનો શરૂ કે વિરોધી નહિ હોવાથી અને સર્વ તેના મિત્ર હોવાથી તે સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

જીવનશુદ્ધિ માટે બીજે મહાન ગુણું પાંચ ઈદ્રિયોના વિષયોથી પરાઙ્મુખતા છે. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ઈદ્રિયોના વિષયો ક્ષણિક સુખ આપવાવાળા છે, હુઃખગર્ભિત છે, પરાશ્રથી છે, તે અન્યા પછી પણ બીજા સુખની આકંસા રહે છે. આપણા

અનુભવ પણું તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું? લગવદ્ગીતા કહે છે કે—

જે મનુષ્ય ઈદ્રિયોના વિષયોને આહાર આપતો નથી, તેનાથી તે વિષયો દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જય છે. ઈદ્રિયોના વિષયોથી દૂર ભાગવાથી વાસનાનો ઉપશમ થાય છે, પણ તેનો ક્ષય થતો નથી. સંસારી મનુષ્ય વિષયોમાં રચ્યોપચ્યો રહે છે અને યતિ સંસારથી જય પામી વિષયોથી દૂર ભાગે છે. બનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારો કે તમે લોજન કરવા એડા છો, થાળા સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખંડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા એડા છો, તમારો હાથ શીખંડ તરફે લંબાવવાની છેલ્લી પળમાં છો. તે વખતે તમે તે શીખંડનો વાડકો ભાણુભાંથી ઝન્હાર મૂકી હો. તમારી જુહ્ણા ઈદ્રિયને ઘણું દુઃખ થશે. તે વખતે તે ઈદ્રિયને જણાવે કે હું તારો સ્વામી છું અને તને આજા કરે છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયોગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઈદ્રિયની આસક્તિ એઠાછી થતી જશે. જયારે તમે ડાઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને એડા હો, ઉત્તમ લજન લલકારાતું હોય તે વખતે ઉલા થઈને ચાલવા માંડો. આ રીતે તમે અવણુવૃત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશો. આવી રીતે પાંચે ઈન્દ્રિયોના સંબંધમાં સમજપૂર્વક પ્રયોગ કરો, અને તમે તેમના પર જય મેળવી શકશો. અને આ પ્રયોગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સહભાવે તેમજ અભાવે તમે એક સરળી મનોવૃત્તિ રાખી શકશો.

આપણને આપણા પોતાના ખળની-આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શરૂને મોઢું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈએ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા ભાગતા હો, તે વાસનાને ક્ષુદ્ર ગણો. એક મહાપુરુષે સેતાનને-મોહ રાજને કહ્યું

“ ज ! मारी पाछण चाल्यो ज. तुं लडवा जेवो शत्रु नथी । ”
 आपणे तो कर्मनी आठ प्रकृति अने तेना १४८ लेह अने तेना नाना
 नाना अनेक भेदोनी गणुनी करी आपणी आत्मशक्तिनुं भान भूली
 गया छीअ. अंधकार गमे तेवुं भोङु होय अने गमे तेट्ला वर्षथी
 चाल्युं आव्युं होय, पण एक दीवासणी प्रकटतां ते सभत्र अंधकार
 नाश पामे छे, तेवी रीते साची सभज प्रकट थतां अनंती कर्मवर्गाण्या
 तरत ज नाश पामवा भाउं छे.

आत्मानी शक्तिनो ध्याल लावो.

अहो ! अनंत वीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।

त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥

आ अनंत शक्तिवाणो आत्मा विश्वने प्रकाश आपवा समर्थ
 छे, अने पोतानी ध्यानशक्तिना प्रभावथी नषे जगतने छक्षववा
 समर्थ छे. आ आत्मबलनो ध्याल लावी भनुष्ये पांच छन्दिण्यो तथा
 भन उपर ज्य मेणववाने प्रथत्न करवो जेइअ.

आपणे कहीअ छीअ डे संतोष समान सुख नहि. आ
 विचारनो घण्या हुकुपयेओग थयो छे. आल्य वस्तुओ, अथवा साधनोना
 संबंधमां भनुष्य अभुक परिअहनी मर्यादा करे, अने संतोष भाने तो
 ते वाक्याप्ति गण्याय, अने ते खास छिछवायेअय छे, पण आत्मिक
 विकासना संबंधमां तो ज्यांसुधी पूर्णता प्राप्त न थाय, त्यांसुधी
 असंतोष रहेवानो-रहेवो ज जेइअ. नेने उच्च साध्य नथी, ते गमे
 ते पगथिये संतुष्ट थई ऐसी ज्य छे. पण जेनुं साध्य अरेखर
 हुच्य छे, ते तो प्रगति कर्यां ज करे छे, एक पछी एक वृत्ति अने
 क्षाय उपर ज्य मेणवतो ज्य छे, अने छेवटे आत्मसाक्षात्कार करे छे.

आज्ञा दिवसनो विषय दीक्षानो होतो. ते संबंधमां हुं एक
 ज वाखत कहेवा भागुं छुं. स्वामी विवेकानंद एक स्थले कहेलुं डे

જગદ્દૃહિતાય અત્મનો મોક્ષાય આત્માનાં જુહોમિ સ્વાહા । જગતના હિતને ખાતર અને આત્માના મોક્ષને ખાતર હું ભારી જાત અર્પણુ કરે છું. દીક્ષામાં પણ આ મે હેતુ રહેલા છે. જેએ દીક્ષા દે છે, તેએનો હેતુ પણ-પોતાનો મોક્ષ અને જગતનું હિત-હોવો જોઈએ. ધર્મા અનુભવીએનું એવું માનવું છે કે મનુષ્ય જેટલે અંશે મુક્ત થયો હોય, તેટલે અંશે બીજાની સારી સેવા ફરી શકે. માટે પરોપકાર કરવા વાસ્તે પણ જીવનશુદ્ધિની આવશ્યકતા છે.

૦૫કિત સુધરી એટલે સમાચિ સુધરી, કરણુ હે સમાચિ એ પણ વ્યક્તિએના સમુદ્દરા સિવાય બીજુ ડોર્ચ અથગ વસ્તુ નથી. માટે તે જીવનને શુદ્ધ બનાવો અને તે દ્વારા બીજાની સેવા કરો.

તા. ૨૭-૮-૩૦

મણિલાલ નથુભાઈ હોશી

